



# ધી સૂરત પીપલ્સ કો-ઓ. બેન્ક લિ.

સ્થાપના : ૧૯૨૨

શિક્ષુલ્સ બેન્ક

રજીસ્ટર્ડ/સેન્ટ્રલ ઓફિસ: "વસુદાતા ભવન", ટીમલીયાવાડ, નાનપુરા, સૂરત-૩૯૫૦૦૧.

ફોન (+ ૯૧-૦૨૬૧) ૨૪૬ ૪૬૨૧ થી ૪૬૨૪

ફેક્સ (+ ૯૧-૦૨૬૧) ૨૪૬ ૪૫૭૭ / ૪૫૯૨

ઈ-મેઇલ: info@spcbl.in

વેબસાઇટ: www.spcbl.in

## વાર્ષિક સાધારણ સભાની નોટીસ

આથી બેન્કના સર્વે સભાસદોને જાણાવવાનું કે, હાલની કોવિડ -૧૯ મહામારીની પરિસ્થિતિમાં અને વાર્ષિક સાધારણ સભા યોજવાની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને તથા સેન્ટ્રલ રજીસ્ટ્રાર કો-ઓપ.સોસાયટીઝ, નવી દિલ્હીના પરિપત્ર અને અન્ય લાગુ કાયદાના અનુપાલન સ્વરૂપ બેન્કની ૯૮મી વાર્ષિક સાધારણ સભા, તા. ૧૫.૧૨.૨૦૨૦ને મંગળવારના રોજ ભારતીય સમય અનુસાર સાંજે ૪.૦૦ કલાકેથી, વિડીયો કોન્ફરન્સિંગ (VC) / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો (OAVM) મારફત નીચે જણાવ્યા મુજબના કામો માટે મળશે જેમાં સામેલ થવા નિમંત્રણ છે.

- તા. ૩૧.૦૭.૨૦૧૯ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધને બહાલી આપવાનું.
- પ્રમુખશ્રીનું પ્રવચન.
- ૨૦૧૯-૨૦ના વર્ષના બેન્કના હિસાબ તપાસણીની ઓડિટર તરફથી આવેલી નોંધ સભા સમક્ષ વાંચી રજૂ કરવાનું.
- બેન્કની બોર્ડે ૨૦૧૯-૨૦ના વર્ષના બેન્કના કામકાજનો અહેવાલ તથા તા. ૩૧.૦૩.૨૦૨૦ના રોજનું સરવૈયુ અને ૨૦૧૯-૨૦ના વર્ષનો નફા-નુકસાનનો હિસાબ રજૂ કર્યો છે, તે સ્વીકારવાનું અને ચોખ્ખા નફાની ફાળવણી કરવા અંગે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કરેલી ભલામણ અનુસારની ફાળવણી મંજૂર કરવાનું તેમજ વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજપત્ર મંજૂર કરવાનું.
- બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કરેલી ભલામણ અને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરીને આધીન ડિવિડન્ડ જાહેર કરવા બાબત.
- સને ૨૦૨૦-૨૧ના વર્ષ માટે બેન્કની બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ભલામણ કર્યા મુજબ સ્ટેટ્યુટરી ઓડિટરની નિમાણુક કરવાનું.
- તા. ૩૧.૦૭.૨૦૧૯ના રોજ મળેલી બેન્કના સભાસદોની સત્તાણુંમી વાર્ષિક સાધારણ સભાએ મંજૂર કરેલા બેન્કના પેટા કાયદાઓના સુધારા – વધારા મ્હે. સેન્ટ્રલ રજીસ્ટ્રાર સાહેબ, સહકારી મંડળીઓ, નવી દિલ્હી તરફથી મંજૂર થઈ આવ્યા છે, તેની નોંધ લેવાનું.
- બેન્કના ડિરેક્ટર્સને કરેલા ધિરાણોની નોંધ લેવાનું.
- બેન્કના એન.પી.એ. થયેલા ખાતાઓ પૈકીના જે ખાતાઓમાં બેન્કની બોર્ડ ઓફ ડિરેક્ટર્સે વર્ષ દરમ્યાન લેણી રકમ માંડવાળ કરવા કે રાહત આપવા ભલામણ કરેલી તેને બહાલી આપવાનું. તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ભલામણ કર્યા મુજબના Decretal લોન ખાતાઓ બંધ કરવાની મંજૂરી મેળવવાનું.
- VC/OAVM મારફત યોજેલી ૯૮મી વાર્ષિક સાધારણ સભામાં હાજર ન રહી શકનારા સભાસદોની ગેરહાજરી મંજૂર કરવાનું.
- પ્રમુખશ્રીની મંજૂરીથી જે રજૂ થાય તે કામો ઉપર વિચારણા કરવાનું તથા નિર્ણય લેવાનું.

તા. ૧૧.૧૧.૨૦૨૦

ડૉ.જતીન નાયક

જનરલ મેનેજર



# ધી સૂરત પીપલ્સ કો-ઓ. બેન્ક લિ.

સ્થાપના : ૧૯૨૨

શિક્ષુલ્ક બેન્ક

રજીસ્ટર્ડ/સેન્ટ્રલ ઓફિસ: "વસુધારા ભવન", ટીમલીયાવાડ, નાનપુરા, સૂરત-૩૯૫૦૦૧.

ફોન (+ ૯૧-૦૨૬૧) ૨૪૬ ૪૬૨૧ થી ૪૬૨૪

ફેક્સ (+ ૯૧-૦૨૬૧) ૨૪૬ ૪૫૭૭ / ૪૫૯૨

ઈ-મેઈલ: info@spcbl.in

વેબસાઈટ: www.spcbl.in

## ખાસ નોંધ:

- જો કોઈ સભાસદને બેન્કના હિસાબ અંગે કોઈ ખુલાસો કે માહિતી જોઈતી હોય તો વાર્ષિક સાધારણ સભા મળવાના ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં તે અંગે બેન્કને લેખિત જાણ કરવી કે જેથી સામાન્ય સભામાં તે અંગેના ખુલાસા કે માહિતી આપી શકાય. વાર્ષિક સાધારણ સભાની નોટીસ અને વાર્ષિક અહેવાલની નકલ સેન્ટ્રલ ઓફિસ, બેન્કની દરેક શાખામાં તથા બેન્કની વેબસાઈટ [www.spcbl.in](http://www.spcbl.in) પર પણ ઉપલબ્ધ છે.
- કોરમના અભાવે સભા મુલતવી રહેશે તો તેજ દિવસે અડધા કલાક બાદ સભા ફરીથી મળશે જે કાયદેસર ગણાશે અને એજન્ડા મુજબની કાર્યવાહી કરશે .
- ફક્ત સભાસદોને જ ઈ-વોટીંગ ધ્વારા મતદાન કરવા દેવામાં આવશે.
- વર્ષ ૨૦૧૯-૨૦ના ડિવિડન્ડની ચુકવણી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મંજૂરી મળ્યા પછી જ કરવામાં આવશે.
- સભાસદોએ નોંધ લેવી કે તા. ૧૫.૧૨.૨૦૨૦ તથા તા. ૧૬.૧૨.૨૦૨૦ દરમિયાન તેઓ તેમના પ્રશ્નો બેન્કના ઈમેઈલ આઈડી [agm@spcbl.in](mailto:agm@spcbl.in) પર મોકલી શકે છે. આ પ્રશ્નોના જવાબ બેંક તા. ૧૭.૧૨.૨૦૨૦ના રોજ બેન્કની વેબસાઈટ [www.spcbl.in](http://www.spcbl.in) પર પ્રદર્શિત કરશે. નોટીસમાં દર્શાવેલા મુદ્દા પર સભાસદો NSDL ની ઈ-વોટીંગ સાઈટ [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com) ઉપર તા.૧૮.૧૨.૨૦૨૦ અને ૧૯.૧૨.૨૦૨૦ના રોજ મતદાન કરી શકશે.
- વિડીયો કોન્ફરન્સિંગ (VC) / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો (OAVM) મારફત સાધારણ સભાની વિગતવાર માર્ગદર્શિકા અને પ્રક્રિયા બેન્કની વેબસાઈટ [www.spcbl.in](http://www.spcbl.in) પર ઉપલબ્ધ છે.
- રીઝર્વ બેન્કના આદેશ અનુસાર દરેક સભાસદના KYC સંબંધિત પુરાવાઓ લેવાનું ફરજિયાત થયેલ હોવાથી જે સભાસદોએ KYC સંબંધિત પુરાવાઓ પુરા નહિ પાડ્યા હોય તેમને આવા પુરાવાઓ પુરા પાડ્યા બાદ જ ડિવિડન્ડ ચુકવાશે.
- જે સભાસદોએ હજી સુધી તેમના વારસદારની નિમણૂક ન કરી હોય તેમને વારસદારની નિમણૂક કરવા વિનંતી છે.
- બેન્કના પેટા કાયદા અનુસાર તથા ભારતના બંધારણમાં થયેલા ૯૭મા સુધારા અનુસાર, બેન્કના દરેક સભાસદે તેમનું સભાસદપણું ચાલુ રાખવા માટે બેન્કની કોઈપણ એક સેવા લેવી ફરજિયાત છે, તેથી બેન્કના દરેક સભાસદ / સભાસદ પેઢીઓને વિનંતી છે કે તેઓ આપની બેંકમાં બચત/ચાલુ ખાતા ખોલાવે કે બેન્કની બીજી કોઈપણ એક સેવા લઈ બેન્કના પેટા કાયદા મુજબ સભાસદપણાના નિયમોનું પાલન કરે જેથી તેમને ચુકવવા પાત્ર ડિવિડન્ડની રકમ ખાતામાં જમા કરાવવામાં સુગમતા રહે.
- જે સભાસદોએ તેમના ઈ-મેઈલ આઈડી બેંકમાં નોંધાવેલા નથી તેઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબર બેન્કની નજીકની શાખામાં અથવા સેન્ટ્રલ ઓફિસ "વસુધારા ભવન " નાનપુરા, ટીમલીયાવાડ, સુરત ખાતે શેર વિભાગમાં તારીખ ૩૦.૧૧.૨૦૨૦ સુધીમાં મોકલી નોંધણી કરાવે.